

ફાર્મ ફાઇનાન્સ અને વર્કિંગ કેપિટલ સોલ્યુશન્સમાં ટોચના પાંચ સુધારા



બેન્કિંગ-
ફાઇનાન્સ
ઉમેશ અરોરા

ખેડૂતો માટે સમયસર ધિરાણ મળવું તે વરસાદના જેટલું જ મહત્વનું છે. તેનાથી તેઓ બિયારણો અને ખાતરો ખરીદી શકે છે, મજૂરી ચૂકવી શકે છે અને પશુધનને સાચવી શકે છે. પરંપરાગત રીતે કાર્યશીલ મૂડી મેળવવી અઘરી હતી જેના લીધે અનેક ખેડૂતોએ ઔપચારિક શાહુકારો પર નભવું પડતું હતું. આજે બેન્કિંગ ઉદ્યોગ ફ્લેક્સીબલ લોન મોડલ્સ પૂરા પાડે છે અને ગ્રામીણ પરિવારોને ધિરાણ મળે તેની સમગ્ર પ્રક્રિયાને નવો ઓપ આપી રહ્યો છે. અહીં એવા પાંચ મુખ્ય સુધારા રજૂ કરવામાં આવ્યા છે જે કૃષિ ધિરાણની ક્ષતિને ટેકો આપે છે:

ફ્લેક્સીબલ રિપેમેન્ટ શિડ્યુલ: સ્ટાન્ડર્ડ લોનમાં જેમ આકરા માસિક હપ્તા હોય છે તેનાથી વિપરિત કૃષિ લોનના માળખા પાકના ચક્ર સાથે ચુકવણી થાય તે પ્રકારે બનાવવામાં આવે છે. ખેડૂતો લણણી લીધા બાદ તેમની લોન ચૂકવે કરી શકે છે જેનાથી મહત્વના મહિના દરમિયાન તણાવ ઓછો રહે છે. આ અભિગમથી ડિફોલ્ટ ઓછા થાય છે અને સ્થિતિસ્થાપકતા વધે છે જેનાથી ખેડૂતો વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે છે. કૃષિ ધિરાણ માટેની માંગ સતત વધી રહી છે જે સમયસર અને ખેડૂતોને અનુકૂળ હોય તેવા ધિરાણની જરૂરિયાત દર્શાવે છે.

વેલ્યુ ચેઇન ફાઇનાન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ

નાણાકીય સંસ્થાઓ લોનને વાસ્તવિક પેદાશના વેચાણ અથવા દૂધ મેળવવા સાથે વધુને વધુ જોડી રહી છે, જેથી એ સુનિશ્ચિત થાય કે ચુકવણી સીધી આવકના પ્રવાહમાંથી થાય છે. તે જ સમયે, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ-પ્રોસેસિંગ યુનિટમાં રોકાણને ટેકો આપે છે. આ સુવિધાઓથી ખેડૂતો ખેતપેદાશનો સંગ્રહ કરી શકે છે, બગાડ ઘટાડી શકે છે અને વધુ સારા ભાવે વેચાણ કરી શકે છે. ડેરીમાં સ્થિર ખરીદી ચુકવણી માટે વિશ્વસનીય આવક સુનિશ્ચિત કરે છે.

કસ્ટમાઇઝ કરેલું ધિરાણ અને વધુ સ્માર્ટ ધિરાણ: સેટેલાઇટ ઇમેજરી, વેધર ડેટા અને ચુકવણીના ઇતિહાસ જેવી સુવિધાઓના લીધે ધિરાણકર્તાઓ વ્યક્તિગત પાક, ખેડૂતો અને પ્રદેશો મુજબ ધિરાણ તૈયાર કરી રહ્યા છે. નાણાં મંત્રાલય દ્વારા બહાર પડાયેલા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના નોટિફિકેશન મુજબ કિસાન કેડિટ કાર્ડ (કેસીસી) 31 ડિસેમ્બર 2024ના રોજ 7.72 કરોડ સક્રિય ખાતાં અને રૂ. 10.05 લાખ કરોડની લોન સાથે કેન્દ્રસ્થાને રહે છે. આટલી બહોળી પહોંચ સાથે કસ્ટમાઇઝડ કેડિટ એ બાબત સુનિશ્ચિત કરે છે કે ગ્રામીણ કૃષિની વાસ્તવિકતાઓને વધુ સારી રીતે સાથે રાખીને સમયસર તથા પ્રસ્તુત રીતે નાણાંકીય ટેકો મળે.

(લેખક- ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના ઇમર્જિંગ બિઝનેસ હેડ છે)